

ગુજરાત સરકાર

નાણા વિભાગ

પરિપત્ર ક્રમાંક: નવય-૧૦-૨૦૨૧-ડી-૨૧૦-પી (પેન્શન સેલ)

સચિવાલય, ગાંધીનગર.

તારીખ:- ૦૫/૦૮/૨૦૨૬

સંદર્ભ:

(૧) નાણા વિભાગના તા.૧૫.૦૩.૨૦૨૪ના જાહેરનામા ક્રમાંક:(GN-20)-NPY-102021-D-19-P(PENSION CELL)

(૨) નાણા વિભાગના તા.૧૪/૦૭/૨૦૨૬ના જાહેરનામા ક્રમાંક:(GN-40)FD/PPR/e-file/4/2022 /2037 /P (Pension)

પરિપત્ર:

વિભાગના સંદર્ભ(૧) હેઠળના જાહેરનામાથી ગુજરાત મુલ્કી સેવા (નવી વર્ધિત પેન્શન યોજના) નિયમો, ૨૦૨૪ના નિયમ-૨૮ માં કર્મચારીઓને પેન્શન ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન પસંદ કરવા વિવિધ વિકલ્પ આપવામાં આવેલ છે. ત્યારબાદ વંચાણે લીધેલ ક્રમાંક (૨) થી નિયમોમાં સુધારો કરવામાં આવેલ છે. ઉક્ત સુધારા બાદ કર્મચારીઓના NPS ખાતામાં જમા ફંડના રોકાણ માટે ઉપલબ્ધ વિકલ્પો નીચે મુજબ છે.

૧). **Active Choice/ Scheme G:** કર્મચારી દ્વારા આ વિકલ્પ પસંદ કરવાથી NPS ફંડનું ૧૦૦% રોકાણ Government Securities (G-Sec)માં કરવામાં આવશે.

૨). **Auto Choice / Life Cycle Funds:** આ વિકલ્પ હેઠળ Subscriberની ઉંમરને ધ્યાને લઈ Equity (E), Corporate Bonds (C) અને Government Securities (G)માં ફંડની ફાળવણી પૂર્વનિર્ધારિત પ્રમાણમાં કરવામાં આવશે. ઉંમર વધવાની સાથે Equityમાં ફાળવણી તબક્કાવાર ઘટતી જશે અને Corporate Bonds (C) અને Government Securities (G)માં વધતી જશે. (એનેક્સર-૧) હાલમાં ઉપલબ્ધ Life Cycle Funds નીચે મુજબ છે:

- Life Cycle Fund 25 – Low (5E/55Y):** આ ફંડમાં ૩૫ વર્ષની ઉંમર સુધી Equityમાં મહત્તમ ૨૫% સુધી રોકાણ કરવામાં આવે છે અને ત્યારબાદ Equityમાં ફાળવણી તબક્કાવાર ઘટીને ૫૫ વર્ષની ઉંમરે ૫% થાય છે.
- Life Cycle Fund 50 – Moderate (10E/55Y):** આ ફંડમાં ૩૫ વર્ષની ઉંમર સુધી Equityમાં મહત્તમ ૫૦% સુધી રોકાણ કરવામાં આવે છે અને ત્યારબાદ Equityમાં ફાળવણી તબક્કાવાર ઘટીને ૫૫ વર્ષની ઉંમરે ૧૦% થાય છે.
- Life Cycle Fund 75 – High (15E/55Y):** આ ફંડમાં ૩૫ વર્ષની ઉંમર સુધી Equityમાં મહત્તમ ૭૫% સુધી રોકાણ કરવામાં આવે છે અને ત્યારબાદ Equityમાં ફાળવણી તબક્કાવાર ઘટીને ૫૫ વર્ષની ઉંમરે ૧૫% થાય છે.


d) **Life Cycle – Aggressive (35E/55Y):** આ ફંડમાં ૪૫ વર્ષની ઉંમર સુધી Equityમાં ૫૦% સુધી રોકાણ કરવામાં આવે છે અને ત્યારબાદ Equityમાં ફાળવણી તબક્કાવાર ઘટીને ૫૫ વર્ષની ઉંમરે ૩૫% સુધી થાય છે.

૩) **Default Scheme:** નવા જોડાનાર કર્મચારી અને હાલના કર્મચારી દ્વારા પેન્શન ફંડ મેનેજર (એનેક્સર-૨) તથા ઇન્વેસ્ટમેન્ટ પેટર્નની પસંદગી કરવામાં નહીં આવે, તો આ નિયમો/સૂચનાઓ અનુસાર Default Scheme હેઠળ રોકાણ ચાલુ રહેશે. Default Scheme હેઠળ ફંડની ફાળવણી ત્રણ પબ્લિક સેક્ટર અન્ડરટેકીંગમાં કરવામાં આવે છે.

કર્મચારીઓ પેન્શન ફંડ મેનેજર (PFM) વર્ષમાં એક વખત બદલી શકશે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન અંગે કર્મચારી નાણાકીય વર્ષમાં બે વખત વિકલ્પ આપી શકશે. જે કર્મચારી માટે સ્વૈચ્છિક રહેશે તથા તે અંગેની કાર્યવાહી cra.nps-proteantech.in ની વેબસાઈટ પર લોગીન કરી કર્મચારીએ સ્વયં કરવાની રહેશે. વેબસાઈટ પર અનુસરવાના તબક્કાવાર પગલા **એનેક્સર-૩** મુજબ છે.

ઉક્ત વિગતો ધ્યાને લઈ કર્મચારી પોતાની પસંદગી અનુસાર પેન્શન ફંડ મેનેજર તથા ઇન્વેસ્ટમેન્ટ પેટર્નની પસંદગી કરી શકશે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,



(પી. એમ. ભરડવા)  
ઉપ સચિવ(પેન્શન & તિજોરી)  
નાણા વિભાગ

નકલ રવાના:-

- માન. રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર
- માન. મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી, સ્વર્ણિમ સંકુલ, સચિવાલય, ગાંધીનગર
- માન. નાયબ મુખ્યમંત્રીશ્રીના અંગત સચિવશ્રી, સ્વર્ણિમ સંકુલ, સચિવાલય, ગાંધીનગર
- માન. નાણા મંત્રીશ્રીના અંગત સચિવશ્રી, સ્વર્ણિમ સંકુલ, સચિવાલય, ગાંધીનગર
- માન. મંત્રીશ્રીઓ/રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ
- સચિવાલયના સર્વે વિભાગો (વિભાગ હસ્તકના સર્વે ખાતાના વડાઓની કચેરીઓને પરિપત્રિત કરવાની વિનંતી સહ)
- સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર
- સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર
- રજીસ્ટ્રારશ્રી, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ
- સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર
- સચિવશ્રી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર
- સચિવશ્રી, ગુજરાત મુલ્કી સેવા ટ્રીબ્યુનલ, ગાંધીનગર
- એકાઉન્ટન્ટ જનરલશ્રી (એ એન્ડ ઇ) ગુજરાત રાજ્ય, અમદાવાદ/રાજકોટ
- એકાઉન્ટન્ટ જનરલશ્રી (ઓડિટ), અમદાવાદ/રાજકોટ
- નિયામકશ્રી, હિસાબ અને તિજોરી, ગાંધીનગર

નિયામકશ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ, ગાંધીનગર

નિરિક્ષકશ્રી, સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી, ગાંધીનગર

પગાર અને હિસાબી અધિકારીઓ, અમદાવાદ/ગાંધીનગર

સ્થાનિક ઓડિટ અધિકારી, અમદાવાદ/ગાંધીનગર.

સિસ્ટમ મેનેજર, નાણા વિભાગની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી માટે

સિલેક્ટ ફાઇલ પેન્શન સેલ શાખા

- પત્ર દ્વારા

| Auto Choice Option (એનેક્સર-૧)                       |                           |     |     |                       |     |     |                   |     |     |                                 |     |     |
|------------------------------------------------------|---------------------------|-----|-----|-----------------------|-----|-----|-------------------|-----|-----|---------------------------------|-----|-----|
| Subscriber Age                                       | Auto Conservative (LC-25) |     |     | Auto Moderate (LC-50) |     |     | Auto High (LC-75) |     |     | Auto Aggressive (LC-Aggressive) |     |     |
|                                                      | E                         | C   | G   | E                     | C   | G   | E                 | C   | G   | E                               | C   | G   |
| Upto 35 years                                        | 25%                       | 45% | 30% | 50%                   | 30% | 20% | 75%               | 10% | 15% | 50%                             | 30% | 20% |
| 36                                                   | 24%                       | 43% | 33% | 48%                   | 29% | 23% | 71%               | 11% | 18% | 50%                             | 30% | 20% |
| 37                                                   | 23%                       | 41% | 36% | 46%                   | 28% | 26% | 67%               | 12% | 21% | 50%                             | 30% | 20% |
| 38                                                   | 22%                       | 39% | 39% | 44%                   | 27% | 29% | 63%               | 13% | 24% | 50%                             | 30% | 20% |
| 39                                                   | 21%                       | 37% | 42% | 42%                   | 26% | 32% | 59%               | 14% | 27% | 50%                             | 30% | 20% |
| 40                                                   | 20%                       | 35% | 45% | 40%                   | 25% | 35% | 55%               | 15% | 30% | 50%                             | 30% | 20% |
| 41                                                   | 19%                       | 33% | 48% | 38%                   | 24% | 38% | 51%               | 16% | 33% | 50%                             | 30% | 20% |
| 42                                                   | 18%                       | 31% | 51% | 36%                   | 23% | 41% | 47%               | 17% | 36% | 50%                             | 30% | 20% |
| 43                                                   | 17%                       | 29% | 54% | 34%                   | 22% | 44% | 43%               | 18% | 39% | 50%                             | 30% | 20% |
| 44                                                   | 16%                       | 27% | 57% | 32%                   | 21% | 47% | 39%               | 19% | 42% | 50%                             | 30% | 20% |
| 45                                                   | 15%                       | 25% | 60% | 30%                   | 20% | 50% | 35%               | 20% | 45% | 50%                             | 30% | 20% |
| 46                                                   | 14%                       | 23% | 63% | 28%                   | 19% | 53% | 32%               | 20% | 48% | 48%                             | 28% | 24% |
| 47                                                   | 13%                       | 21% | 66% | 26%                   | 18% | 56% | 29%               | 20% | 51% | 46%                             | 26% | 28% |
| 48                                                   | 12%                       | 19% | 69% | 24%                   | 17% | 59% | 26%               | 20% | 54% | 44%                             | 24% | 32% |
| 49                                                   | 11%                       | 17% | 72% | 22%                   | 16% | 62% | 23%               | 20% | 57% | 42%                             | 22% | 36% |
| 50                                                   | 10%                       | 15% | 75% | 20%                   | 15% | 65% | 20%               | 20% | 60% | 40%                             | 20% | 40% |
| 51                                                   | 9%                        | 13% | 78% | 18%                   | 14% | 68% | 19%               | 18% | 63% | 39%                             | 19% | 42% |
| 52                                                   | 8%                        | 11% | 81% | 16%                   | 13% | 71% | 18%               | 16% | 66% | 38%                             | 18% | 44% |
| 53                                                   | 7%                        | 9%  | 84% | 14%                   | 12% | 74% | 17%               | 14% | 69% | 37%                             | 17% | 46% |
| 54                                                   | 6%                        | 7%  | 87% | 12%                   | 11% | 77% | 16%               | 12% | 72% | 36%                             | 16% | 48% |
| 55 + till retirement                                 | 5%                        | 5%  | 90% | 10%                   | 10% | 80% | 15%               | 10% | 75% | 35%                             | 15% | 50% |
| E-Equity, C-Corporate Bond, G-Government Securities. |                           |     |     |                       |     |     |                   |     |     |                                 |     |     |

| એનેક્ષર-૨ |                                                           |
|-----------|-----------------------------------------------------------|
| Sr. No.   | Fund Name                                                 |
| 1         | ADITYA BIRLA SUNLIFE PENSION FUND MANAGEMENT LIMITED      |
| 2         | AXIS PENSION FUND MANAGEMENT LIMITED                      |
| 3         | DSP PENSION FUND MANAGERS PRIVATE LIMITED                 |
| 4         | HDFC PENSION FUND MANAGEMENT LIMITED                      |
| 5         | ICICI PRUDENTIAL PENSION FUNDS MANAGEMENT COMPANY LIMITED |
| 6         | KOTAK MAHINDRA PENSION FUND LIMITED                       |
| 7         | LIC PENSION FUND LIMITED                                  |
| 8         | SBI PENSION FUNDS PRIVATE LIMITED                         |
| 9         | TATA PENSION FUND MANAGEMENT PRIVATE LIMITED              |
| 10        | UTI PENSION FUND LIMITED                                  |

### એનેક્સર – ૩

- સૌપ્રથમ ગુગલમાં "https://cra.nps-proteantech.in/CRA/" વેબસાઈટ પર જવું. જેમાં ખાતેદારનો User ID માં ખાતેદાર નો ૧૨ અંકનો PRAN નંબર દર્શાવાવી પાસવર્ડ ની મદદથી લોગ -ઈન થવાનું રહેશે.

The screenshot shows the National Pension System (NPS) CRA portal. The header includes the Protean logo, NPS logo, and the slogan "#Zaruri Hai". The main content area is divided into two sections. On the left, there is a list of services: Annual Transaction Statement on Email, UPS Passbook, My Withdrawal Utility, Invest in NPS, Activate Tier II Account (Free !!), FATCA Compliance, Know Your Pension (NPP), and Subscriber Consent to share contact details with ASP. On the right, there is a "Subscribers" login section. It has two tabs: "NPS" (selected) and "UPS". The login fields include PRAN (NPS), Password, and Enter Captcha (13 + 6 = 19). There is a "Submit" button and a "Mobile PAN based Login" option. Below the login section, there are links for "Reset Password", "PRAN Search", "IPIN for eNPS", and "Help/Instructions for Login". At the bottom, there is a "Nodal Offices / Other Intermediaries" section with tabs for "I-PIN" and "Digital Certificate". It includes fields for User ID, Password, and Enter Captcha (9 9 + 5 =). There is also a "Submit" button and a checkbox for "I understand that".

- વેબસાઈટ ખુલ્યા બાદ Transact Onlineના મેનુમાં જઈને Changes Scheme Preference ઉપર ક્લિક કરવું. ત્યારબાદ Investment Choice Change Requestમાં Tier Typeમાં Tier-1 સીલેક્ટ કરી Submit બટન પર ક્લિક કરવું.

The screenshot shows the National Pension System (NPS) CRA portal after logging in. The header includes the Protean logo, NPS logo, and the slogan "#Zaruri Hai". The main content area is divided into two sections. On the left, there is a list of services: Annual Transaction Statement on Email, UPS Passbook, My Withdrawal Utility, Invest in NPS, Activate Tier II Account (Free !!), FATCA Compliance, Know Your Pension (NPP), and Subscriber Consent to share contact details with ASP. On the right, there is a "Subscribers" login section. It has two tabs: "NPS" (selected) and "UPS". The login fields include PRAN (NPS), Password, and Enter Captcha (13 + 6 = 19). There is a "Submit" button and a "Mobile PAN based Login" option. Below the login section, there are links for "Reset Password", "PRAN Search", "IPIN for eNPS", and "Help/Instructions for Login". At the bottom, there is a "Nodal Offices / Other Intermediaries" section with tabs for "I-PIN" and "Digital Certificate". It includes fields for User ID, Password, and Enter Captcha (9 9 + 5 =). There is also a "Submit" button and a checkbox for "I understand that".

- હાલમાં કાર્યરત Standard Preferenceની વિગતો દર્શાવતી સ્ક્રીન ખુલશે જેમાં Submit બટન પર ક્લિક કરવું.

**protean** **nps** **#Zaruri Hai** **National Pension System (NPS)**

Welcome Home | Logout

Make Transaction - Manage My Account - Account Statement - Goal Planner - Track Transaction - Manage My Withdrawal -

Investment Choice Change Request

\* Mandatory Fields

PRAN  
Tier Type  
Date of Birth  
Age  
Scheme-Preference Type  
Scheme %  
Scheme Preference Change Counter  
PFM Change Counter

Note  
➤ Change in your Investment choice requires OTP based authentication through SMS. Kindly ensure that your mobile number is registered with CRA.

**Submit**

- હાલમાં કાર્યરત Standard Preferenceની વિગતો દર્શાવતી સ્ક્રીન ખુલશે જેમાં Submit બટન પર ક્લિક કરવું. સ્ક્રીમની પસંદગી કરીને તેમાં દર્શાવેલ PFM (પેન્શન ફંડ મેનેજર) Name ના પોપઅપ મેનુમાંથી કોઈ એક PFM ની પસંદગી કરી નીચે Submit પર ક્લિક કરવું.

**protean** **nps** **#Zaruri Hai** **National Pension System (NPS)**

Welcome Home | Logout

Make Transaction - Manage My Account - Account Statement - Goal Planner - Track Transaction - Manage My Withdrawal -

Investment Choice Change Request

Existing Investment Choice

\* Mandatory Fields

Scheme-Preference Type  
PFM Name  
Scheme %  
Scheme Preference Change Counter  
PFM Change Counter  
PRAN  
Tier Type  
Name  
Date of Birth  
Age

[Click here](#) to compare scheme performance using PRIDE

**New Investment Scheme Choice**

Scheme Preference Type:

☐ Active Choice  
☐ Life Cycle 25 - Low (5E / 55 Y)  
☐ Life Cycle 50 - Moderate (10E / 55 Y)  
☐ Life Cycle 75 - High (15E / 55 Y)  
☐ Life Cycle - Aggressive (20E / 55 Y)  
☐ Default Choice

**Submit** **Reset** **Cancel**

- સ્કીમની પસંદગી કરીને તેમા દર્શાવેલ PFM (પેન્શન ફંડ મેનેજર) Name ના પોપઅપ મેનુમાથી કોઈ એક PFM ની પસંદગી કરી નીચે Submit પર ક્લિક કરવું.

[Click here](#) to compare scheme performance using PRIDE

**New Investment Scheme Choice**

|                        |                                     |                                                                                                                                                                                                                                               |                                      |
|------------------------|-------------------------------------|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|--------------------------------------|
| Scheme Preference Type | <input type="radio"/> Active Choice | <input type="radio"/> Life Cycle 25 - Low (5E / 55 YY)<br><input type="radio"/> Life Cycle 50 - Moderate (10E / 55 Y)<br><input type="radio"/> Life Cycle 75 - High (15E / 55 Y)<br><input type="radio"/> Life Cycle - Aggressive(35E / 55 Y) | <input type="radio"/> Default Choice |
|------------------------|-------------------------------------|-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|--------------------------------------|

SubmitResetCancel

- ત્યારબાદ Subscriber એ જે નવા PFM અને Scheme Preference Typeની પસંદગી કરેલ છે તેની વિગતો દર્શાવતી વિન્ડો ખુલશે જેમા SEND OTP બટન પર ક્લિક કરવુ. રજીસ્ટર્ડ મોબાઈલ નંબર તથા ઈ-મેઈલ આઈ-ડી પર OTP આવશે તે OTP નાખીને SUBMIT OTP બટન પર ક્લિક કરવુ.



National Pension System (NPS)

Welcome

Home | Logout

Make Transaction

Manage My Account

Account Statement

Goal Planner

Track Transaction

Manage My Withdrawal

Investment Choice Change Request Confirmation Screen

PRAN  
Name  
Tier Type  
Scheme Preference Type  
Auto sub type

OTP sent succesfully to mobile number +919\*\*\*\*\*8

PFM Name

Regenerate OTP

Cancel

Submit OTP

Retired life ka sahara, NPS hamara